https://archive.org/details/bk1024/page/n0/mode/1up

2019-11 -History of Umiya Mataji Vandhay -Uma Darpan (1024)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

૨૪
નવેમ્બર-૨૦૧૯

ઉમા દર્પણ
દીપોત્સવી અંક
માનદ્ તંત્રી-રતિલાલ પટેલ
અંક-૨૬૫ • કુલ પેજ-૧૦૮ • છૂટક કિંમત રૂ. ૨૦ • આજીવન લવાજમ રૂ.૨૦૦૦

# ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની ૭૫ વર્ષની યશસ્વી વિકાસયાત્રા

સંતશ્રી લાલરામજી

જૂનું મંદિર



સંતશ્રી ઓધવરામજી

યજ્ઞશાળા

ઉમિયા માતાજી નૂતન મંદિર

શિવમંદિર

ઇશ્વરરામજી મહારાજનો ઢોલીયો



https://archive.org/details/bk1024/page/n1/mode/1up

# Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3, 4, 5, 6, 7.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1024/page/n2/mode/1up

2019-11 -History of Umiya Mataji Vandhay -Uma Darpan (1024)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:20:52 +05'30'
Real Patidar Unravel Truth

ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયનું મુખપત્ર
૨૪
ઉમા દર્પણ
૧૯૯૬-૨૦૧૯
નવેમ્બર-૨૦૧૯

# ઉમા દર્પણ

દીપોત્સવી અંક

માનદ્ તંત્રી-રતિલાલ પટેલ
અંક-૨૬૫ • કુલ પેજ-૧૦૮ • છૂટક કિંમત રૂ. ૨૦ • આજીવન લવાજમ રૂ.૨૦૦૦

## ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની ૭૫ વર્ષની યશસ્વી વિકાસયાત્રા

સંતશ્રી લાલરામજી

સંતશ્રી ઓધવરામજી

યજ્ઞશાળા

ઉમિયા માતાજી નૂતન મંદિર

શિવમંદિર

ઇશ્વરરામજી મહારાજનો ઢોલીયો

https://archive.org/details/bk1024/page/n3/mode/1up



realpatidar.com

# ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાયની ૭૫ વર્ષની યશસ્વી વિકાસયાત્રા

1944

-રમેશ પોકાર દ્વારા

વિક્રમ સંવત ૨૦૦૦માં કચ્છ અને સાબરકાંઠામાં સંતશ્રી ઓધવરામજી મહારાજની પ્રેરણાથી સનાતન જાગૃતિનું અભિયાન વેગ પકડી ચૂક્યું હતું અને કચ્છના ગામોમાં ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો બંધાવવાનું પણ શરૂ થઇ ચૂક્યું હતું. એવે સમયે સંતશ્રી ઓધવરામજીના શિષ્ય દયાલદાસજી મહારાજ સુધારક ભાઈઓની સાથે સાબરકાંઠામાં ધર્મજાગૃતિ માટેની સભાઓ યોજી રહ્યા હતા.

જયારે મોતીસરી કંપાના અગ્રણી ભાઈશ્રી હરિભાઇ કરમશીએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે વાંઢાયની પવિત્ર ભૂમિ પર ઉધવ આશ્રમમાં જ્ઞાતિને એકતાંતણે.જોડી રાખનાર કુળદેવી મા ઉમિયાનું મંદિર બંધાવવું જોઇએ.

આ વાતની સંતશ્રી ઓધવરામજી સમક્ષ રજૂ કરતાં તેઓશ્રીએ આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકૃતિ પ્રદાન કરી અને તેમના આશીર્વાદથી વિક્રમ સંવત ૨૦૦૦ના મહા સુદ પાંચમ (વસંતપંચમી)ના શુભ દિને સંતશ્રીના આશીર્વાદથી મંદિરની ખાતમુહૂર્તવિધિ કરવામાં આવી, એ સમયે સર્વશ્રી રતનશીભાઇ ખીમજી (વિરાણી), રાજારામભાઈ સામજી (માનકૂવા), કરશનભાઈ ઉકેડા (દેશલપર), કાનજીભાઇ ગોપાલ (વેસલપુર), વીરજીભાઇ પરબત પટેલ (મથલ), જીવરાજભાઇ વસ્તા (માનકૂવા), જીવરાજભાઇ હીરજી ઉકાણી (માનકૂવા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉમિયા માતાજી મંદિરનું નિર્માણકાર્ય પૂરું થઇ જતાં વિક્રમ સંવત ૨૦૦૦ ને ચૈત્ર સુદ નોમ (રામનવમી)ના દિવસે કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના પ્રમુખ શ્રી રતનશીભાઇ ખીમજી ખેતાણીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી નવનિર્મિત મંદિરમાં ઉમિયા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. શ્રી હરિભાઇ કરમશીના પુત્રો ડાહ્યાભાઈ તથા મેઘજીભાઈના હસ્તે યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી અને શ્રી હરિભાઈના હસ્તે કળશ (શિખર)નું સ્થાપન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલી સભાઓમાં શ્રી રતનશીભાઇ ખીમજી ખેતાણી, શ્રી નથુભાઇ નાનજી કેશરાણી, શ્રી રવજીભાઇ લાલજી (લુડવાવાળા) અને સંતશ્રી ઓધવરામજી મહારાજ દ્વારા પ્રસંગોચિત પ્રવચન પણ કરવામાં આવ્યા હતા.

ખાત મુહૂર્ત
30-Jan-1944

આ પ્રસંગે સર્વશ્રી રામજીભાઇ જેઠા (નખત્રાણા), વેલજીભાઇ ભાણજી ભગત (બોરડી ટીંબા કંપા), મનજીભાઇ જેરામ મિસ્ત્રી (માધાપર), જશાભાઈ કાનજી પાંચાણી (નખત્રાણા) વગેરે ભાવિકોએ યથાશક્તિ યોગદાન નોંધાવી વિવિધ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

હાલે જ્યાં ઉમિયા માતાજીનું મંદિર છે, ત્યાં તે સમયે મૂળ જૂનો દ્વારો હતો. સંત શ્રી વિહારીસાહેબ, શ્રી ઈશ્વરરામજી, શ્રી લાલરામજી અને શ્રી ઓધવરામજી જેવા સંતોએ ત્યાં તપશ્ચર્યા કરી હતી. સંતો અને પાટીદાર જ્ઞાતિના વડીલોએ વાવેલું એ બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે, પરંતુ પ્રારંભિક તબક્કામાં

Opening
02-Apr-1944



realpatidar.com

https://archive.org/details/bk1024/page/n4/mode/1up



realpatidar.com

ઉમિયા માતાજી સંસ્થાન પરિસર.

આ સ્થાનમાં ઉમિયા માતાજીનું નાનકડું મંદિર હતું અને થોડાક ઓરડા માત્ર બંધાયા હતા.

વિકાસના પ્રથમ તબક્કામાં ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવી, જેમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા દેશલપરથી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું અને ઈ.સ. ૧૯૭૧માં સંસ્થામાં વીજળીકરણ પણ થયું. આ સમયગાળા દરમ્યાન સંસ્થાએ ગૌશાળાનો પ્રારંભ કર્યો અને અલાયદી જમીન મેળવી ઉમિયા બાગની યોજના હાથ ધરી.

ઈ.સ. ૧૯૭૪માં ઉમિયા માતાજી મંદિરના પટાંગણમાં ઓધવરામ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. આ બધી યોજનાઓને કાર્યાન્વિત કરવા કચ્છ અને કચ્છ બહારના દાતાઓનો ઉલ્લેખનીય સહયોગ સંસ્થાને સાંપડ્યો હતો.

સંતશ્રી વાલરામજી મહારાજની પ્રેરણાથી હરિદ્વાર ખાતે એક કથા-પારાયણનું આયોજન કરાયું હતું એ નિમિત્તે એકત્ર થયેલ ફંડમાંથી સંતશ્રીએ રૂ. ૫૧,૦૦૦ ઉમિયા માતાજી મંદિરે અન્નક્ષેત્ર શરૂ કરવા માટે અર્પણ કરવાની ભાવના વ્યક્ત કરી, એ સમયના પાટીદાર સમાજના આગેવાનોએ સંતશ્રી વાલરામજી મહારાજના આ વિચારને વધાવી લીધો અને તા. ૨૮-૩-૧૯૭૭ના રોજ ઉમિયાદેવી અને ઈશ્વરરામજી અન્નક્ષેત્રની રચના કરવામાં આવી, જેના પ્રથમ પ્રમુખશ્રી પ્રેમજી રામજી અમૃતિયા વરાયા અને ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા આવતા તમામ યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું.

અન્નક્ષેત્રના ખર્ચને પહોંચી વળવા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની વસ્તીવાળાં ગામોમાંથી કુટુંબ દીઠ રૂ. ૧૦૦ નું દાન મેળવવાનું પણ શરૂ કરાયું અને ખેડૂતો તરફથી ઘઉંનું દાન પણ લેવાનું શરૂ કરાયું. આ કાર્ય માટે પ્રમુખશ્રી પ્રેમજીબાપા તેમજ તે સમયના ટ્રસ્ટીઓ અને આગેવાનો ગામેગામનો પ્રવાસ પણ કરતા હતા. આ કાર્યમાં ખાસ કરીને ખેડૂતો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હતો.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ૧૯૭૭માં યોજાયેલ દ્વિતીય અધિવેશનમાં જ્ઞાતિમાં સમૂહલગ્નો યોજવા અંગેનો ઠરાવ કરાયો હતો અને એ બાબત ઉપર વિશેષ ભાર પણ મુકાયો હતો. સમાજના આ અભિગમને મૂર્ત સ્વરૂપ આપવાનો ઉમિયા માતાજી ટ્રસ્ટે તા. ૨-૧૧-૧૯૮૦ની કારોબારીમાં નિર્ણય કર્યો અને રૂપિયા ૨૫૧ની રકમ લઈને કોઈ પણ વિસ્તારના જ્ઞાતિજન સમૂહલગ્નમાં જોડાઈ શકશે એવો પણ નિર્ણય કરાયો અને ઈ.સ. ૧૯૮૦થી જલતી કરાયેલી આ સમૂહ લગ્નરૂપી જ્યોત ૪૦ વર્ષથી અવિરત પણે ચાલુ છે અને ઉમિયા માતાજી સંસ્થાનમાં અક્ષયતૃતીયા અને વસંતપંચમી એમ વર્ષમાં બે દિવસોએ સમૂહલગ્નો યોજાતાં રહ્યાં છે.

ધીરે ધીરે લોકોમાં સમૂહ લગ્ન પ્રત્યે જાગૃતિ આવતા કચ્છનાં જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક સમાજો દ્વારા સમૂહલગ્નો યોજાવા લાગ્યાં અને ઉમિયા માતાજી સંસ્થાનમાં આવતાં લગ્નાર્થીઓ પોતપોતાના ગામ કે વિસ્તારમાં યોજાતાં સમૂહલગ્નોમાં જોડાવા લાગ્યાં. તેમ

ઉમાપતિ મહાદેવ મંદિરના શિલાન્યાસ પ્રસંગની તસવીર.



realpatidar.com

https://archive.org/details/bk1024/page/n5/mode/1up



realpatidar.com

છતાં ઉમિયા માતાજી સંસ્થાન ખાતે તો સમૂહલગ્ન યોજાવાનું ચાલુ જ રહ્યું છે.

ઈ.સ. ૨૦૦૯માં દેશલપરની આસપાસનાં ૧૬ ગામોની સમૂહલગ્ન સમિતિએ આ કાર્યની જવાબદારી ઉઠાવી લેતાં આ કાર્યમાં વેગ આવ્યો છે. વાંઢાયની આસપાસનાં ૨૦ ગામનાં તેમજ અન્ય વિસ્તારનાં યુગલો ઉમિયા માતાજી સંસ્થાન ખાતે આ સમિતિ દ્વારા યોજાતા સમૂહલગ્નમાં જોડાઈને મા ઉમિયાના આશિષ મેળવે છે.

સને ૧૯૮૨માં ઉમિયા માતાજી ટ્રસ્ટના પ્રમુખપદે ડૉ. વી. એચ. પટેલની વરણી કરવામાં આવી. ઉમિયા માતાજી સંસ્થાનમાં જરૂરી બાંધકામ અને વિકાસની જવાબદારી આ ટ્રસ્ટે સંભાળી ત્યારે અન્નક્ષેત્ર અને ભોજનાલયની જવાબદારી ઉમિયા દેવી અને ઈશ્વરરામજી ટ્રસ્ટના શિરે રહી.

સને ૧૯૮૩માં યાત્રાળુઓને ઊતરવા માટે ત્રણ માળનું વિશ્રાંતિગૃહનું બાંધકામ શરૂ કરાયું. તેમાં કુલ્લે ૧૫ રૂમો બંધાયા. વિશ્રાંતિગૃહનું નામકરણ શ્રી રવિલાલભાઈ કેશરા રામજીયાણીએ તેમના પિતાશ્રી કેશરાભાઈ રામજીયાણીના સ્મરણાર્થે રૂ. ૫૧,૦૦૦ આપીને કરાવ્યું હતું, જેનું ઉદ્‌ઘાટન ૧૯૮૪માં સંતશ્રી વાલદાસજી મહારાજના હસ્તે કરાયું હતું. એ નિમિત્તે પ્રકાશિત થયેલ સ્મરણિકાનું વિમોચન પણ તા. ૯-૪-૧૯૮૪ના કરવામાં આવ્યું હતું. આ વર્ષે મંદિરનું આધુનિકીકરણ કરવામાં આવ્યું અને સંસ્થાના વિકાસ માટે બે પ્લોટોની ખરીદી કરવામાં આવી.

સને ૧૯૮૫માં સંસ્થાએ સંપાદિત કરેલ ઉમિયા બાગની જમીન પર નીલગીરીનું વાવેતર કરવાનું નક્કી થયું.

તા. ૧૭-૪-૧૯૮૬ના યોજાયેલ ઉમિયા માતાજી ટ્રસ્ટની સામાન્ય સભામાં ટ્રસ્ટના પ્રમુખપદે શ્રી નારાણભાઈ રામજી પોકારની અને મંત્રી પદે છગનલાલ પ્રેમજી અમૃતિયાની વરણી થઈ, આ કાર્યભાર તેમણે સતત આઠ વર્ષ લગી સંભાળેલો હતો. તેમના સમય ગાળામાં માતુશ્રી રતનબાઈ વિશ્રામ પોકાર પથિકાશ્રમનું નિર્માણ થયું તેમજ અન્નપૂર્ણાભવનનું બાંધકામ પણ તેમના સમયમાં જ પરિપૂર્ણ થયું.

૧૯૮૬માં શિક્ષણસમિતિની રચના કરવામાં આવી હતી, જેના પ્રમુખ તરીકે ડૉ. વી. એચ. પટેલ નિયુક્ત

*મા ઉમિયાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરતા દાતા પરિવાર.*

થયા હતા અને જ્ઞાનપ્રચાર સમિતિની રચના કરવામાં આવી હતી. જેનાં પ્રમુખ તરીકે શ્રી પ્રેમજી રામજી અમૃતિયા નિયુક્ત થયા હતા.

સને ૧૯૯૧થી ૧૯૯૪ દરમિયાન ઉમિયાદેવી તથા શ્રી ઈશ્વર રામજી અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખપદે શ્રી શિવદાસભાઈ ગોવિંદ છાભૈયા અને મંત્રીપદે શ્રી નારાણભાઈ વિશ્રામ ભગતે સેવા આપી હતી. ઉમિયા માતાજી સંસ્થાન ખાતે આવેલું ભોજનાલય નાનું પડતું હોવાથી હાલે જે ભોજનાલય છે તેનું નિર્માણ આ સમય દરમ્યાન કરવામાં આવ્યું.

૧૯૮૭માં ગોવિંદભાઈ મેઘજી મદનપુરાવાળા તરફથી ઉમિયા માતાજી પરિસરમાં મુખ્ય પ્રવેશદ્વાર બંધાવી આપવામાં આવ્યું.

૧૯૮૯માં ઉમિયા માતાંજી સંકુલમાં પ્રેરણામૂર્તિ સંતશ્રી ઓધવરામજી મહારાજની મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામાં આવી.

૧૯૯૦માં દેશલપરથી વાંઢાય તરફનો અને ભુજ તરફનો એમ બે ગેઈટ માતુશ્રી ભચીબેન રતનશી છાભૈયાના સ્મર્ણાર્થે નારણભાઈ રતનશી છાભૈયા, રાજપર તરફથી બંધાવી આપવામાં આવ્યા, અને ૧૯૯૩ના લુડવાથી વાંઢાય તરફનું પ્રવેશદ્વાર શ્રી લધાભાઈ વિશ્રામ પોકાર તરફથી બાંધી આપવામાં આવ્યું.

સને ૧૯૯૪થી ૧૯૯૯ દરમિયાન ઉમિયા માતાજી ટ્રસ્ટના પ્રમુખપદે જેઠાભાઈ લાલજી ચોપડા અને મંત્રીપદે કરસનભાઈ પચાણ ચૌહાણે સેવાઓ આપી હતી. આ સમયગાળામાં અન્નપૂર્ણાભવનને અડીને ઉમિયાભવનનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યાર બાદ ભોજનાલયના ઉપરના ભાગમાં ગેસ્ટહાઉસનાં રૂમો બાંધવામાં આવ્યા,



realpatidar.com

https://archive.org/details/bk1024/page/n6/mode/1up



realpatidar.com

ઈ.સ.૧૯૯૦માં રામનવમી પ્રસંગે ધર્મસભામાં પ્રવચન આપતાં વાલદાસજી મહારાજ.

જેનું નામ દાતાશ્રી માતુશ્રી રતનબેન વિશ્રામ પોકાર લાલરામ ભવન રાખવામાં આવ્યું, જેનું ઉદ્‌ઘાટન ૧૯૯૭માં કરાયું અને ઉમા મહેશ્વર ભોજનાલય હોલનું ઉદ્‌ઘાટન દાતાશ્રી મનજીભાઈ વાલજી સાંખલા ઉખેડાવાળા અને શ્રી મણિલાલ પૂંજા રામાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

કચ્છ અને કચ્છ બહારના લક્ષ્મીનારાયણ મંદિરોને એકસૂત્રે બાંધવા અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર કરવાના ઉદ્દેશ્યથી ૧૯૯૬માં શરૂ થયેલ શ્રી લક્ષ્મીનારાયણ ધર્મપ્રચાર સમિતિએ ૨૦૦૩ સુધી ઉમિયા માતાજી સંસ્થાનમાં જ પોતાનું કાર્યાલય રાખીને તમામ પ્રવૃત્તિઓ કરી હતી. જ્યાં સુધી હાલનું લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, સંસ્કારધામ અસ્તિત્વમાં નહોતું આવ્યું ત્યાં સુધી આ સંસ્થાનું કેન્દ્રસ્થાન ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય જ રહ્યું હતું. અહીં જ ધર્મપ્રચાર સમિતિની સભાઓ અને મિટિંગો યોજાતી હતી. આ ધર્મપ્રચાર સમિતિના પ્રમુખપદે શ્રી પ્રેમજીભાઈ પુંજા વાસાણી વરાયા હતા.

ડો. વી. એચ. પટેલ ૧૯૯૪થી ૧૯૯૯ દરમિયાન ઉમિયા દેવી અને ઈશ્વરરામજી અન્નક્ષેત્રના પ્રમુખપદે સેવા આપીને નિવૃત્ત થયા.

સને ૧૯૯૬માં ઉમિયા માતાજી ટ્રસ્ટે તેનું મુખપત્ર ઉમા દર્પણનું પ્રકાશન શરૂ કર્યું, જેના માનદ્ તંત્રીપદે શ્રી રતિલાલ મનજી પટેલ નિયુક્ત થયા. સને ૧૯૯૮માં ઉમિયા માતાજી મંદિરનો સુવર્ણજયંતી મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો.

૧૯૯૯માં ઉમિયા દેવી ઈશ્વરરામજી અન્નક્ષેત્ર ટ્રસ્ટ અને ઉમિયા માતાજી ટ્રસ્ટનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને એક જ ટ્રસ્ટ શ્રી ઉમિયા માતાજી ઈશ્વરરામજી અન્નક્ષેત્ર ટ્રસ્ટ રાખવામાં આવ્યું

સને ૧૯૯૯થી ૨૦૦૮ દરમિયાન ઉમિયા માતાજી ટ્રસ્ટના પ્રમુખપદે શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુએ તેમની બહુમૂલ્ય સેવાઓ આપી. ૧૯૯૯થી ૨૦૦૦ દરમિયાન શ્રી માધવજીભાઈ પ્રેમજી અમૃતિયા મંત્રીપદે રહ્યા હતા સને ૨૦૦૨થી ૨૦૦૮ દરમ્યાન શ્રી શિવજીભાઈ નાનજી કાનાણીએ મંત્રીપદે રહીને તેમની સેવાઓ આપી હતી.

સને ૨૦૦૧માં કચ્છમાં વિનાશક ભૂકંપ આવતાં કચ્છનાં ગામોમાં ઘણાં મકાનો ધ્વંસ થઈ જતાં તાત્કાલિક સહાયની આવશ્યકતા ઊભી થઈ, એ સમયે ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટ અસરગ્રસ્તોની વહારે થયું અને કચ્છના કડવા પાટીદારોની વસ્તીવાળાં ગામોમાં ભૂંકપગ્રસ્તોનાં મકાન બાંધવા તદ્દન રાહત ભાવે ૮૦ હજાર થેલી સિમેન્ટનું વિતરણ કર્યું. આ કાર્ય માટે દાતાઓ તરફથી તેમજ ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા તરફથી સંસ્થાને દાન પણ મળ્યું હતું.

સને ૧૯૯૮માં કંડલામાં ત્રાટકેલા વાવાઝોડા વખતે પણ જ્ઞાતિનાં ભાઈ-બહેનોને મદદ કરવા રૂપિયા પાંચ લાખની વ્યાજમુક્ત લોન આપી હતી. સંસ્થાએ સુરતમાં પૂરપીડિતો માટે ફૂડપેકેટો મોકલીને માનવ સેવાનાં કાર્યમાં તેનું યોગદાન આપ્યું હતું.

તા. ૧૭-૪-૨૦૦૫માં સંતશ્રી ઓધવરામજી મહારાજની બાજુમાં તેમના ગુરુ બ્રહ્મલીન સંતશ્રી

તા. ૫/૪/૯૮ના અખિલ ગુજરાત પાટીદાર પરિષદ દ્વારા ઉમિયા માતાજી સંસ્થાને એનાયત કરાયેલો એવોર્ડ સ્વીકારતા સંસ્થાના પ્રમુખ શ્રી જેઠાભાઈ ચોપડા



realpatidar.com

https://archive.org/details/bk1024/page/n7/mode/1up



realpatidar.com

લાલરામજી મહારાજની મૂર્તિનું સ્થાપન કરાયું અને જ્ઞાતિનાં આર્થિક રીતે નબળાં કુટુંબોને તબીબી સહાય કરવા આરોગ્યનિધિની પણ શરૂઆત કરવામાં આવી. ભુજમાં ઉમાદર્પણ માટે કાર્યાલય તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે ઉમાહોલ સંસ્થા દ્વારા ખરીદવામાં આવ્યો અને તેનું ઉદ્‌ઘાટન દાતાશ્રી વાલજીભાઈ જીવરાજ દિવાણી (સાગર) અને લધાભાઈ વિશ્રામ પોકાર - મુંબઈના હસ્તે કરવામાં આવ્યું.

તા. ૧૩-૨-૨૦૦૬ના ભૂકંપમાં જર્જરિત થઈ ગયેલ ઉમિયા માતાજી મંદિરના સામેના પટાંગણમાં નવા ઉમિયા માતાજી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો જેના મુખ્ય દાતા રામભરોસે હસ્તે દેવજીભાઈ ભાવાણી - સુરત રહ્યા હતા. જે મંદિરની જમીન ભૂમિદાનમાં વાંઢાયના દરબાર ભાઈઓ પાસેથી મળી છે.

સને ૨૦૦૮થી ૨૦૧૪ સુધી ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટના પ્રમુખપદે શ્રી રવિલાલભાઈ કેસરા રામજીયાણી અને મંત્રીપદે શ્રી જયેશભાઈ સોમજી છાભૈયા કાર્યરત હતા. ૨૦૦૯માં ઉમિયા માતાજીનું શિલ્પકળાથી સુશોભિત મંદિર તૈયાર થઈ જતાં તેમાં ઉમિયા માતાજી મૂર્તિ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. નવેમ્બર ૨૦૦૯માં ઉમિયા માતાજી મંદિરની બાજુમાં જમીન સંપાદિત કરી શિવમંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો, જેનું નિર્માણકાર્ય પૂરું થતાં વર્ષ ૨૦૧૨ના રામનવમીના પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.

સને ૨૦૧૪થી શ્રી ઉમિયા ઈશ્વરામજી ટ્રસ્ટના પ્રમુખપદે શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુ અને મંત્રીપદે શ્રી બાબુભાઈ સામજી ચોપડા કાર્યરત છે.

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મના માર્ગે વાળવાની પ્રેરણા આપનાર સંતશ્રી લાલરામજી મહારાજની વિ.સં. ૨૦૭૧માં ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્વાણ શતાબ્દી ઉજવવામાં આવી હતી. જેમાં ભુજ લેવા પટેલ હૉસ્પિટલને આઇ.સી.યુ.ની સુવિધા સાથેની એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન તબીબી સારવાર કેમ્પો યોજવામાં આવ્યા હતા. આરોગ્યનિધિ સાથે સંતશ્રી લાલરામજીનું નામ જોડવામાં આવ્યું અને દાતાઓની નોંધણી કરવામાં આવી હતી. વર્ષ દરમ્યાન વૃદ્ધ, અપંગ, અશકત

ઉમાદર્પણના પ્રથમ અંકના વિમોચન વેળાની તસવીર.

અને નિરાધાર લોકોને અન્ન-વસ્ત્રનું દાન કરવામાં આવ્યું હતું.

ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાયમાં તબ્બકાવાર જુદા જુદા વિશ્રાંતિ ભવનો બાંધવામાં આવ્યા છે. જેના બાંધકામને ત્રણ ચાર દાયકાનો સમય થઈ ગયો છે તેથી આ બધા ભવનોને આજના સમય મુજબના આધુનિક સુવિધાથી સુસજજ કરવાની જરૂર જણાતી હતી. તેથી ક્રમે ક્રમે આ બધા ભવનોનું રિનોવેશન કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

સંસ્થાના પ્રથમ ભવન પથિકાશ્રમનું રિનોવેશન કામ પૂરું પણ થઈ ચૂકયું છે. આ ભવનમાં જૂના ટોયલેટ બાથરૂમ આજના સમય મુજબ તે સુવિધાયુકત બનાવવામાં આવ્યા છે. બારી, બારણા, ફર્નિચર અને ફલોરિંગ બદલીને દરેક રૂમને નવા જ રંગરૂપ આપવામાં આવ્યા છે અને તેમાં ૧૬ રૂમને એ.સી.વાળા બનાવવામાં આવ્યા છે. આ રૂમોના મૂળ દાતાની તકતી કાયમી રાખી યોગ્ય જગ્યાએ રિનોવેશનના દાતાની તકતી લગાવવામાં આવશે, જેની ફીક્ષ રકમ રૂપિયા દોઢ લાખ રાખવામાં આવી છે.

હાલમાં ઉમિયા ભવનનું નવીનીકરણનું કામ પ્રગતિમાં છે, એ પૂરું થયા પછી લાલરામ ભવનનું રિનોવેશનનું કામ હાથમાં લેવામાં આવશે. આ બન્ને ભવનોના રિનોવેશનના દાતાઓની રકમ રૂપિયા એક લાખ મુકરર કરવામાં આવી છે. જેમાં રૂમના મૂળ દાતાઓને અગ્રીમતા આપવામાં આવશે.

સંસ્થામાં વધતી જતી યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં લઈ સ્ત્રી-પુરુષો માટેના અલાયદા ટોયલેટ બાથરૂમનું નવેસરનું નિર્માણ કરવામાં આવી રહયું છે તેની ઉપર વોશિંગ



realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 6 of 8

https://archive.org/details/bk1024/page/n8/mode/1up

2019-11 -History of Umiya Mataji Vandhay -Uma Darpan (1024)

realpatidar.com

શ્રી ઉમિયા માતાજી મંદિર હીરક જયંતી વર્ષ નિમિત્તે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો ૧૧૩૩ દર્દીઓએ લાભ લીધો હતો તે વેળાની પ્રથમ તસવીરમાં દર્દીને તપાસતા ડૉક્ટર તેમજ બાજુમાં દર્દીઓ દેખાય છે.

રૂમ લોટ્રી બાંધવાનું કાર્ય પ્રગતિમાં છે.

આ સંસ્થામાં સમયાંતરે જુદા જુદા હોદ્દા ઉપર રહીને સેવા આપનારા સર્વશ્રી શિવગણભાઈ રાજા રૂડાણી, સામજીભાઈ જીવરાજ લીંબાણી, લાલજીભાઈ ભાણજી પોકાર, મનજીભાઈ વાલજી સાંખલા, પ્રેમજીભાઈ પૂંજા વાસાણી, ખીમજીભાઈ નાગજી લીંબાણી, મણિભાઈ પૂંજા રામાણી, કેશરાભાઈ કરસન રામજીયાણી, પ્રેમજીભાઈ શિવગણ રૂડાણી, દેવજીભાઈ વાલજી ચૌહાણ, ધનજીભાઈ પૂંજા લીંબાણી, નારણભાઈ રતનશી છાભૈયા, ગોવિંદભાઈ અબજી સેંઘાણી, અબજીભાઈ વિશ્રામ કાનાણી, લધાભાઈ મેઘજી પટેલ, વાલજીભાઈ નારણ ભગત, કાનજીભાઈ રામજી ભીમાણી, હરિભાઈ કાનજી માવાણી, લધાભાઈ વિશ્રામ પોકાર, પ્રેમજીભાઈ ખીમજી પોકાર, સામજીભાઈ હરજી સેંઘાણી, બાબુલાલ હીરજી ચૌહાણ, વિશનજીભાઈ હરિ માવાણી, ધનજીભાઈ ગોવિંદ સેંઘાણી, લખમશીભાઈ લધા વાસાણી, મેઘજીભાઈ જેઠા રામજીયાણી, માવજીભાઈ વસ્તા છાભૈયા વગેરે મુખ્ય હતા.

વર્ષ ૨૦૧૭થી કાર્યરત હોદ્દેદારોમાં પ્રમુખ શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુ, ઉપપ્રમુખ સર્વશ્રી ગંગારામભાઈ શિવદાસ રામાણી અને મણિલાલ હીરજીભાઈ ભગત, મહામંત્રી શ્રી બાબુલાલ સામજી ચોપડા, મંત્રી સર્વશ્રી રમેશભાઈ બાબુલાલ ધોળુ, ઈશ્વરભાઈ નાનજી ભાવાણી, છગનલાલ નાનજીભાઈ રામજીયાણી, ખજાનચી શ્રી ગંગારામભાઈ શિવગણ ચૌહાણ અને ટ્રસ્ટીઓમાં સર્વશ્રી ધનજીભાઈ શિવગણ રૂડાણી, ધનજીભાઈ પૂંજા લીંબાણી, રવિલાલ કેશરાભાઈ રામજીયાણી, સામજીભાઈ નારાયણ નાકરાણી, શિવજીભાઈ નાનજી કાનાણી, દેવજીભાઈ માવજી લીંબાણી, રામજીભાઈ કરમશી નાકરાણી, પ્રો કે.વી. પાટીદાર, ઈશ્વરભાઈ માવજી માવાણી અને ડૉ. પ્રેમજીભાઈ રામજી ઘોઘારી સેવારત છે.






realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1024/page/n9/mode/1up



realpatidar.com

# અ. ભા. ક. ક. પા. વેલાણી-વાસાણી પરિવારના પિતૃદેવનો ઉત્સવ ઉજવાયો

-ઉપેન્દ્ર વેલાણી દ્વારા

જિયાપર ખાતે ધ્રબુઆ પર્વતની તળેટીમાં આવેલા વેલાણી-વાસાણી પરિવારના પિતૃદેવ શ્રી વાલાદાદાના સ્થાનકે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર વેલાણી-વાસાણી પરિવારનો વાર્ષિક પાટોત્સવ રાબેતા મુજબના કાર્યક્રમોની હારમાળા સાથે ઉમંગ અને ઉત્સાહના વાતાવરણ સાથે તા. ૨૬ અને ૨૭/૯/૧૯ના એટલે કે તેરસ અને ચૌદશ દરમ્યાન પરિવારો અને આજુબાજુના ચાર ગામોએ સાથે રહીને ઉજવ્યો હતો.

તા. ૨૬/૯/૧૯ તેરસના સવારે ૭.૩૦ કલાકે હોમ-હવન વિધિ કરવામાં આવી હતી. ત્યારપછી ૯.૩૦ કલાકે સંસ્થાના પ્રમુખ શ્રી પરસોત્તમભાઇ વિશ્રામ વાસાણીના અધ્યક્ષસ્થાને વાર્ષિક જનરલ સભા યોજવામાં આવી હતી.

ઉપપ્રમુખ શ્રી શિવલાલભાઇ વાસાણી (દરશડી-મુંબઇ)એ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ઉપપ્રમુખ શ્રી કરસનભાઇ વેલાણી (ભુજ)એ બે દિવસના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

મંત્રી શ્રી ઉપેન્દ્રભાઇ વેલાણી (કલ્યાણપર)એ ગત મિનિટ્સનું વાંચન કર્યું હતું. જ્યારે વાર્ષિક હિસાબોની રજૂઆત મંત્રી શ્રી રમેશભાઇ વેલાણી (દિશલપર)એ કરી હતી.

તા. ૨૭/૯/૧૯ ચૌદશના વિવિધ ચડાવાની ઉછામણી લેવામાં આવી હતી. જેમાં વાઘાનો ચડાવો ગંગાબેન અરજણભાઇ વેલાણી પરિવાર હસ્તે પુત્રો (દુર્ગાપુર), ફૂલહારનો ચડાવો સર્વશ્રી ગંગારામભાઇ વિશ્રામ વાસાણી, ચંદુભાઇ મેઘજી વાસાણી (દિશલપર), ધજાનો ચડાવો ગંગાબેન અરજણભાઇ વેલાણી પરિવાર હસ્તે પુત્રી (દુર્ગાપુર), મહાઆરતીનો ચડાવો સર્વશ્રી મગનભાઇ માવજી વેલાણી, અમૃતભાઇ રવજી વેલાણી અને નરશીભાઇ હીરજી વેલાણી (માનકૂવા-મુંબઇ)એ લીધો હતો.

પરિવારના વિકાસમાં રૂા. ૫૧,૦૦૦થી વધુનું દાન જમણમાં લખાવશે તેમનું આજીવન દાતા તરીકેનું નામ તકતીમાં લખાવવાનું પરિવારે સર્વાનુમતે નક્કી કર્યું છે.

આ ઉપરાંત સંકુલની અંદર નવા રૂમો બનાવવાનું પરિવારે સમય પ્રમાણે આગળ વધશું એવું નક્કી કર્યું હતું અને નર્મદાનું પાણી મંગવાણા સમ્પમાંથી સ્થાનકે ભારતીય જનતા પાર્ટીના કેશુભાઇ વાસાણીના પ્રયત્નોથી આપણા સંકુલને તા. ૧૯/૯/૧૯ના મળી ગયું છે.

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઇ વાસાણી અને માંડવી તાલુકાના એપીએમસી માર્કેટયાર્ડમાં બીજી ટર્મમાં ચૂંટાયેલા શ્રી પ્રવીણભાઇ વેલાણીનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી કેશુભાઇએ સન્માનના પ્રત્યુત્તરમાં પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.

તા. ૨૬/૯/૧૯ તેરસની પૂર્વસંધ્યાએ પરિવારના ભાઇઓ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટોત્સવ પ્રસંગની તસવીરો.



realpatidar.com